

# ઉપધાન તપ એક સોનેરી તક



• પ્રેરક-આશીર્વાદ •  
પ.પુ. ગરછાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્ વિજય  
પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ

• પ્રકાશક •

શ્રી ૧૦૮ પાર્થનાથ ભક્તિવિહાર કૈન ટ્રસ્ટ  
શંખેશ્વર


नम्र सूचन

इस ग्रन्थ के अभ्यास का कार्य  
पूर्ण होते ही नियत समयावधि में  
शीघ्र वापस करने की कृपा करें।  
जिससे अन्य वाचकगण इसका  
उपयोग कर सकें।

# નમો નમરકાર મણ્ણ

નમો અરિહંતાણં  
નમો સિદ્ધાણં  
નમો આચરિયાણં  
નમો ઉવજાયાણં  
નમો લોએ સવ્વસાહૃણં  
એસો પંચ નમુક્કારો  
સવ્વ-પાવઘણાસણો  
મંગલાણં ચ સવેસિં  
પટમં છવઈ મંગલં

શ્રી રંગેશ્વરમંત્રિ પાર્થનાથાય નમ:  
શ્રી ધર્મ-ભક્તિ પ્રેમ-સુલોધ-લભિય જુગણ્યો નમ:



# ઉપધાન તપ એક સોનેરી તક

• પ્રેરક-આશીર્વાદ •

પ.પૂ. ગરણાધિપતિ આચાર્યદિવ શ્રીમહ વિજય  
પ્રેમસૂરીશરણ મહારાજા સાહેબ

• પ્રકાશક •

શ્રી ૧૦૮ પાર્થનાથ ભક્તિવિહાર ફૈન ટ્રેડ

શ્રી ૧૦૮ પાર્થનાય બાક્તિ વિલાર કેળ દુર્ગા ના  
પાંગણે પથમવાર જ દારોટ ઉપાયન તપ ના

- ૧ વિજયાચા -

શ્રી ૧૦૮ પાર્થનાય બાક્તિવિલાર મહાયાત્રાના પ્રેરક ગરછાદિપતિ  
પ.પૂ.આચાર્યાચિત્પત્તિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા

પ.પૂ.આચાર્યાચિત્પત્તિ શ્રી વિજય બાનુયંદસૂરીશ્વરજી મ.સા.

પ.પૂ. પંચાયાપવર શ્રી હેમયંદ વિજયજી મ.સા.,

પ.પૂ. પંચાયાપવર શ્રી સ્તલશોખર વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી ચંદ્રશોખર વિજયજી મ.સા..,

પ.પૂ.મુનિરાજશ્રી મણપોઠન વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી નિત્યાનંદ વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી શીલશ્રી વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી વિદ્યાર્થ વિજયજી મ.સા. (એચ-કોડાયવાણા),

પ.પૂ.મુનિરાજશ્રી કલ્પોન્ડ વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી કુલયંદ વિજયજી મ.સા. (K.C.),

પ.પૂ.મુનિરાજશ્રી ભક્તિરાલન વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી પ્રશાંતશોખર વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી કુલદર્શન વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી કલ્પનોહિ વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી ભાત્યરાલ વિજયજી મ.સા.,

પ.પૂ.મુનિરાજશ્રી સિદ્ધરાલ વિજયજી મ.સા.,

પ.પૂ.બાલમુનિરાજશ્રી હેમદર્શન વિજયજી મ.સા.,

પ.પૂ.બાલમુનિરાજશ્રી ભાગયંદ વિજયજી મ.સા., આદિનાયા.

તથા ઉપસ્થિત સાધ્વીતૃદે

પ. અચાર્યાદિપતિશ્રીજીના સાયાજયવર્તી પ. પ. સા. શ્રી હેમતાશ્રીજી મ. આદિનાયા

તેમજ પૂ.પ. સા. શ્રી વિદ્યુતાભાષીજી મ. આદિનાયા...

## ઉપદાનની મહત્તમા

ઉપદાન એટલે સાંસારિક જંજાળોમાંથી મુક્ત બની આત્માની નિકટતા પામવાની પ્રક્રિયા.

ઉપદાન એટલે યોગોદ્ધણ...સાધુ મહાત્માઓને અમુક સૂત્ર ભણવા હોય તો યોગ કરવા જ પડે, તો જ તેને તે સૂત્ર ભણવાનો અધિકાર મળે.

યોગ માં તપ-જપ-કિયાની સાધના છે.

તપથી તન શુદ્ધ થાય.

જપથી મન શુદ્ધ થાય,

કિયાથી જીવન શુદ્ધ થાય.

આ શુદ્ધિ દ્વારા આત્મા નિર્મણ થાય છે. પછી જે સૂત્રો ભણવામાં આવે તે સારી રીતે પરિણમે છે.

સાધુની જેમ શ્રાવકનો પણ નમસ્કાર મહામંત્ર, ઈરીયાવહી તસ્સ ઉત્તારી, અન્નાંથા, લોગસા, નમુંથુણાં, અરિહંત યેઈયાણાં, પુકખરવરદીવહે, સિદ્ધાણાં બુદ્ધાણાં, વૈચાવચ્ચાગરાણાં વિ. સૂત્રો ભણવા માટે યોગ્યતા કેળવવી પડે, તે માટે યોગ કરવા પડે.

ઉપદાન રૂપ યોગોદ્ધણ દરેક શ્રાવક-શ્રાવિકાએ ફરજુયાત કરવાના હોય છે. તેનાથી સૂત્રશુદ્ધિ-અર્થશુદ્ધિ અને જીવન શુદ્ધિ થાય છે.

ઉપદાન વગર મળેલા સૂત્રો ઉધાર લીધેલા માલ જેવા છે. તે સુપરણિત બનતા નથી.

શાસ્ત્રમાં છ પ્રકારનાં શ્રાવકના ઉપદાન બતાવાયા છે.



- (૧) પંચમંગળ મહાશ્રુતસ્કર્ંધ (નવકાર) સૂત્રનું પ્રથમ ઉપદાન ૧૮ દિવસનું
- (૨) પ્રતિક્રમણ શ્રુતસ્કર્ંધ (ઈરિયાવહી, તસ્સ ઉતારિ) સૂત્રનું બીજુ-ઉપદાન ૧૮ દિવસનું.
- (૩) શક્ષસ્તવાદ્યયન (નમુટથ્યાણં) સૂત્રનું ગ્રીજુ ઉપદાન ૩૫ દિવસનું.
- (૪) ઘૈત્યસ્તવાદ્યયન (અરિહંત ઘેઈયાણં-અન્નાત્ય) સૂત્રનું ચોથુ ઉપદાન ૪ દિવસનું.
- (૫) નામસ્તવાદ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપદાન ૨૮ દિવસનું.
- (૬) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુફ્ખરવરદીવહે, સિદ્ધાણં બુદ્ધાણં, પૈયાવદ્યાગરાણં) સૂત્રનું ૭ દિવસનું. કુલ ૧૧૦ દિવસ થાય. તે તે ઉપદાનના તપ-જ્યુ નિયત કરાયેલા છે.

### ઉપદાનમાં ઉપવાસ

૧. ૧૨ || (કુલ ૧૧૦ દિવસમાં
૨. ૧૨ || દ્વા ઉપવાસ કરવાના હોય)
૩. ૧૬ ||
૪. ૨ ||
૫. ૧૫ ||
૬. ૪ ||

પૂર્વકાલિન ઉપદાન અને આજે થતા ઉપદાનમાં ઘણું તારતમ્ય જોવા મળે.

પૂર્વે થતા ઉપદાનનોમાં આજે જે રીતે ચકાયક નિવિઓ થાય છે એવી નિવિઓ ન હતી.



તપ ઉપવાસ અને આયંબિલથી જ થતો હતો.

પૂર્વકાળમાં આ રીતે ઉપધાન થયા હતા.

## ઉપધાન દિવસ

તપ

- |      |  |
|------|--|
| ૧ ૧૬ | પ્રથમ પાંચ ઉપવાસ + ૮ આયંબિલ+૩ ઉપવાસ  |
| ૨ ૧૬ | પ્રથમ પાંચ ઉપવાસ + ૮ આયંબિલ+ ૩ ઉપવાસ<br>(આ રીતે ૧૬ દિવસમાં ૧૨ ઉપવાસો તપ થતો) |
| ૩ ૩૫ | ૩ ઉપવાસ + ૩૨ આયંબિલ  |
| ૪ ૪  | ૧ ઉપવાસ + ૩ આયંબિલ   |
| ૫ ૨૮ | ૩ ઉપવાસ + ૨૫ આયંબિલ  |
| ૬ ૭  | ૧ ઉપવાસ + ૫ આયંબિલ + ૧ ઉપવાસ   |

આજે પણ કોક પુન્યાત્માઓ આ મૂળવિધિથી ઉપધાન કરતા  
નજરે પડે છે.

પણ મનની ટીલાસ, તનની નબળાઈ, સંયોગોની આધિનતા  
વિ. કારણે પૂર્વોચ્ચાર્યોએ આ મૂળ વિધિમાં થોડા ફેરફાર કર્યા, કારણ  
અત્ય સત્ત્વવાળા પણ આ તપ સાધનામાં જોડાઈ શકે.

આયંબિલના બદલે નિવિઝો આવી ગઈ. જોકે આ ફેરફાર કરવા  
ઇતાં તપમાં કોઈ ઓછાસ કરી નથી, દિવસ વધાર્યા (૧૬ ના અટાર  
દિવસ કર્યા) પણ સરવાળે તપ એટલો જ રાખ્યો.

પહેલા અટારીયામાં કુલ ૧૨ ઉપવાસ થવા જોઈએ, જે પૂર્વે ૮  
ઉપવાસ અને ૮ આયંબિલ = ૪ ઉપવાસથી થતા હતા.

આજે ૧૮ દિવસ માં ૧૨ ઉપવાસનો તપ પૂર્ણ કરવાનો હોય છે.  
જે આ રીતે થાય છે.

## દિવસ તપ કુલ ઉપવાસ

|    |        |   |           |
|----|--------|---|-----------|
| ૬  | ઉપવાસ  | = | ૬ ઉપવાસ   |
| ૮  | નિવિ   | = | ૮ ઉપવાસ   |
| ૮  | પરિમુટ | = | ૯ ઉપવાસ   |
| ૧  | આયંબિલ | = | ૦॥ ઉપવાસ  |
| ૧૮ | ૧૨ ॥   | = | ૧૨॥ ઉપવાસ |

આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસ થયા (ઉપવાસ અને આયંબિલ નું પરિમુટ તપમાં ગણાતું નથી, નિવિનું ગણાય, એક પરિમુટ = ૦॥ ઉપવાસ)

બીજુ ઉપધાન (બીજુ અટારીયુ) પણ એજ રીતે તપ-જ્યથી કરવાનુ.


આજે પહેલુ-બીજુ-ચોથુ અને છદુ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ કરવામાં આવે છે. પછી પાંત્રીસુ (બીજુ ઉપધાન) અને અટઠચાવીશુ (પાંચમુ ઉપધાન) કરવામાં આવે છે.

ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ અણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ઉપવાસ + ૫ આયંબિલ + ૧ ઉપવાસ કરાવાય છે.

પાંત્રીસુ અને અટઠચાવીશુ ઉપવાસ નિવિથી કરાવાય છે.

આ મણે ઉપધાન આજે પણ કોઈને મૂળવિધિથી કરવું હોય તો ખુશીથી કરી શકે છે.

નિવિમાં પારાવાર રાગ-દ્રેષ થવાની શક્યતા છે. જ્યારે આયંબિલમાં અનાસકતભાવ કેળવાય છે. જુબડી ઢેકાણે રહે છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્રેષની હોનારત સર્જતી નથી.



## ઉપધાનના ઉપકરણો

● કટાસણુ ● ચરવળો (પુરુષોએ ગોળ દાંડીનો, બહેનોએ ચોરસ દાંડીનો) ● મુહુપતિ ( ૩-૪ ) ● ખેસ-ઘોતીયા ( અણેક જોડ - બહેનોએ પોતાના વરાઓ ) ● સંથારો ● ઉત્તરપણો ● ગરમ સાલ ● નાક વિ. સાફ કરવા ગરમ ટુકડો ● સુતરનો કંદોરો ● નવકારવાળી ● કાનમા નાંખવા રૂ ● નોટ ● પેન ● પંચ્યુ ● રૂમાલ ● બ્લેંકેટ ● સ્વાધ્યાયની ચોપડી વિ.

## પ્રાભાતિક કિયા

### સવારે ગુરુમહારાજ પાસે કરવાની કિયા

પૌષધ ઉચ્ચરવો, પડિલેહણના આદેશ માગવા, ત્યારબાદ છરિયાવહિયં કરી ખમાસમણ ઈચ્છાકારેણ સંદિસણ ભગવન વસતિ પવેં ? ( ગુરુ આદેશ આપે એટલે ) ઈચ્છં કહી, ખમા. ભગવાન સુદ્ધાવસહિ ( ગુરુ કહે તહેતિ ) ખમા ઈચ્છાકારેણ સં. ભ. પવેયણા મુહુપતિ પડિલેહું ? ઈચ્છં કહી મુહુપતિ પડિલેહવી, બે વાંદણાં દેવાં. ખમા. ઈચ્છા, સં. ભ. પવેયણાં પવેં ? ( ગુરુ કહે પવેવો ) ત્યારબાદ ઉપધાનના નામ પદના નામપૂર્વક બોલી પાલી કહે ત્યારે તપ હોય તો તપ કરશું, એમ કહેવું. નિવિ હોય તો પારણું કરશું, એમ કહેવું. ત્યારબાદ ખમાસમણ, ઈચ્છાકારી ભગવનું પસાય કરી પચ્યકખાણનો આદેશ આપશોજુ. પછી પચ્યકખાણ લેવું. પછી બે વાંદણા, ખમા. ઈચ્છા સં. ભ. બેસણે સંદિસાહું, ખમા ઈચ્છા. સં. ભ. બેસણે ઠાઉં ? ખમા. ઈચ્છા. સં. ભ. સજાય કરું ? પછી સજાય કરવી. પછી રાઈ મુહુપતિ પડિલેહવી. ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ.



## સાંદ્યા કિયા

### સાંજે ગુરુ મહારાજ પાસે કરવાની વિધિ

પડિલેહણના આદેશ માંગવા, ત્યારબાદ 'ઈરિયાવિહિયં' કરી ખમા. છચ્છા. સં.ભ.મુહુપતિ પડિલેહું ? કહી મુહુપતિ પડિલેહવી. વાંદળાં બે દેવાં. (ઉપવાસ હોય તો વાંદળાં નહિ) ખમા. દઈ છચ્છકારી ભગવન પસાય કરી પર્યક્ખાણનો આદેશ દેશોજુ. ત્યારબાદ પર્યક્ખાણ લેવું. પછી બે વાંદળા. ખમા... છચ્છા સં.ભ. બેસણે સંદિસાહું ? ખમા.ઈચ્છા. સં.ભ. બેસણે ઠાઉ ? ખમા. ઈચ્છા. સં.ભ. સ્થંડિલ પડિલેહું ? ખમા. છચ્છા. સં.ભ.દિશિ પ્રમાજું ? ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ.

### મુટઠસી પર્યક્ખાણ પારવાનો વિધિ

#### મુટઠીવાળી નવકાર ગણી

મુટઠસી પર્યક્ખાણ ફાસિઅં પાલિઅં સોહિયં તીરિયં કિણ્ણિયં આરાહિયં જ્યં ચ ન આરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડ.



## ૩૪ સવારે ઉઠી સાંજ સુધી ઉપદાનમાં શું શું કરવાનું છે. ?

૧. સવારે ચાર વાગે ઉઠી સાત નવકાર ગણવા. પછી માત્રાદિની શંકા ટાળી સ્થાપનાભું આગળ ખમા. હરિ કરી ગમણાગમણે આલોવી કુસુમિણ દુસુમિણનો ચાર લોગસ્સનો કાઉસગ કરી અનુકૂળતા હોય, તો ખમા ઇચ્છા સંદિભગવન પ્રથમ ઉપદાન પાંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે કાઉસગ કરું ? ઇચ્છં. પ્રથમ ઉપદાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થે. કરેભિ કાઉસગં. વંદણવત્તિયાએ કહી ઉપદાનનો ૧૦૦ લોગસ્સનો (સાગરવર ગંભીરા સુધી) કાઉસગ કરવો. પારીને લોગસ્સ. કહેવો.
૨. પછી પ્રતિકમણ કરવું. ચાર થોયો પછી નમુંથુણાં કહ્યા પછી આઠ પહોરનો પૌષ્ટિ ઉચ્ચરવો. પ્રતિકમણ પુરુ કરી પડિલેહણ-દેવવંદન કરવાં.
૩. સો ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે જઈ કિયા કરવી.
૪. શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમઃ આ પદ બોલીને સો ખમાસમણાં દેવાં. દહેરાસર જઈ આઠ થોયે દેવવંદન કરવું.
૫. છ ઘડી દિવસ ચઢે પોરિસી ભણાવવી. વ્યાખ્યાન સાંભળવું.
૬. ૧-૨-૪-૬૮૮૧ ઉપદાનવાળાએ નવકારમંત્રની બાંધી ૨૦ નવકારવાળી ગણવી ૩-૫ મા ઉપદાનવાળાએ લોગસ્સની ત્રણ



નવકારવાળી તથા જીવવિચાર નવતત્ત્વ આદિ પ્રકરણોની ૨૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવો. ગાથાઓનો સ્વાધ્યાય કરતા પહેલા ઇરિયાવહી. કરવી.

૭. પુરિમહૃણું પરચ આવેથી સ્થાપનાજુ ખુલ્લા રાખી વિધિપૂર્વક પરચ પારવું નીવી કે આયંબિલ કર્યા પછી ઉઠતાં તિવિહારનું પરચ કરવું પછી ઇરિ કરી ભગવાન ખુલ્લા રાખી જગચિંતામણીનું ચૈત્યવંદન જ્યવીરાય સુધી કરવું પછી સ્વાધ્યાય આદિ કરવો.
૮. સાંજે ચાર વાગે પડિલેહણમાં (વાંદણા દીઘા વગર સીધી આદેશ માંગવાના પછી પડિલેહણ-દેવવંદન કરી ગુરુ મહારાજ પાસે આવી સાંજની કિયા કરી રે માંડલાં કરવા-સ્થાંડિલ પડિલેહવાં.)
૯. પ્રતિક્રમણ કરી, એક પ્રછર રાખ્યા બાદ સંથારા પોરિસી ભણાવવી, સૂતી વખતે કાનમાં કુંડલ (૩ નાં પૂમડાં) નાખવા. ઉંઘ ન આવે ત્યાં સુધી શુભ ભાવના ભાવવી. મહાપુરુષોના પવિત્ર ચરિત્રાનું સ્મરણ કરવું.
૧૦. શ્રાવિકાઓએ સવારે તથા સાંજે કિયા વખતે ફરીથી પૌખધ આદિના આદેશો ગુરુ મહારાજ પાસે માંગવાં. સવારે રાઈએ મુણ કિયા પછી અને સાંજે દેવસીએ મુણ કિયા પૂર્વે પડિલેહવી.



યાદ રહે, તમે વિસ્તૃત બન લો, તમારું શુદ્ધ ન જાણ  
જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું ?  
એ જમણું લો....

- \* તમામ કિયાઓ અપ્રેમતાભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ઉપયોગ પૂર્વક કરવી.
- \* બોલતી વખતે ઉધાડા મોટે ન બોલાય, મુહુપત્તિ આડી રાખીને બોલવું.
- \* ચાલતા, નીચે જોઈને ચાલવું. કોઈ જુવ પગ નીચે કચડાઈ ના જાય તેની તકેદારી રાખવી.
- \* કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજાઈ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘર્ષો ન થવો જોઈએ.
- \* બેસતી વખતે કટાસણા વગર ન બેસાય.
- \* સંસાર છ દિવસ માટે છોડી દીઘો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહીં.
- \* મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી
- \* સૂર્યાસ્ત બાદ માગ્રુ કરવું વિ. અનિવાર્ય કારણ સિવાય છલન ચલન કરાય નહિં, એક સ્થાને બેસવું. કાર્ય પડતા દંડાસણનથી ભૂમિ પુંજતા પુંજતા જતું.
- \* બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપકરણોના બોલ બોલવા પૂર્વક પ્રતિલેખન કરવું.





- \* દિવસ દરમ્યાન છે કઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના બુકમાં નોંધ રોજ સાંજે યાદ કરીને કરી લેવી.
- \* ઘરેણાં પહેરાય નહીં, તેલ નંખાય નહીં, વાળ ઓળાય નહીં, શરીરની ટાપટીપ થાય નહીં, હજામત થાય નહીં, તેલ માલિસ થાય નહિં.
- \* જમતા એંઠા મોટે બોલાય નહીં, જરૂર પડે પાણી વાપરીને બોલવું.
- \* પ્રતિલેખન વિ. કિયાઓ કરતા એક અક્ષર બોલવો નહીં,
- \* મૌન પણે કિયા કરવી (બોલ મનમાં ઉપયોગ પૂર્વક બોલવા)
- \* માત્ર જમીન જોઈને જીવ રહિત ભૂમિ ઉપર પરછવવું. પરછવતા પહેલા અણુજાણાં જસ્સુગગણો (૧વાર) અને પરછવ્યા પછી વોસિરે (ત્રણ વાર) મનમાં બોલવું માત્રાનો પ્યાલો હાથમાં હોય ત્યારે બોલાય નહીં.
- \* કિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર અર્થનો સ્વાધ્યાય કરવો, ધાર્મિક પુસ્તક વાંચવા, નિંદા-કુથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળી ને ખાક થઈ જાય છે.
- \* ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાય નહીં.
- \* પ્રતિલેખન ન કર્યું હોય તે વસ્તુ વપરાય નહીં.
- \* જ્યાં કાજો ના લીધો હોય ત્યાં બેસાય નહીં.
- \* ભોજન મંડપમાં પ્રવેશતા જયણા મંગલ બોલવું, જમવાની જગ્યાએ કાજો લેવો, થાળી વાટકા વિ. પુંજુ -પ્રમાણુ વાપરવા.
- \* મુહુપત્તિ - ચરવળો સાથે જ રાખવા, એક હાથથી દુર મુકવા નહીં.





- \* રાત્રે કાનમાં કુંડલ ફરજીયાત નાખવા અથવા કપડું બાંધવું.
- \* કાળવેળાઓ કાંબળી ઓઠચા વગર બહાર જવું નહીં.
- \* દિવસના સુવું નહીં.
- \* છાપા-ચોપડીઓ-મેગેગીનો વિ. વંચાય નહિં.
- \* પુછચા વગર કોઈની વસ્તુ લેવી નહિં, વાપરવી નહીં.
- \* નિવિમાં જરૂર પુરતું લેવું-એઠું-મુકવાથી દિવસ પડે.
- \* હાથ, પગ, મોઢુ, શરીર ધોવાય નહીં, ભીના કપડાના પોતા કે સ્પંચ પણ થાય નહીં.
- \* પાણી ધી ની જેમ વાપરવું.
- \* સ્થાંડીલ-માત્ર જતા પાણીનો ઉપયોગ જરૂર પુરતો જ ઓછામાં ઓછો કરવો.
- \* કિયા કરતા પંચેન્દ્રય મનુષ્ય કે તીર્યચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વરચેથી જાય) તો ઇચ્છિયાવણી કરી લેવી. જ્યાંથી કિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી.
- \* આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્થાંડિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોઈ, વાડાનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે જગ્યાના રાખવી જરૂરી છે.
- \* પહેલા પ્યાલામાં રખ્યા નાખવી, સ્થાંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષમ જંતુઓ ચોંટતા નથી.
- \* પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પુરતો જ ઉપયોગ કરવો.
- \* ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીના એઠા બિંદુઓ જો સુકાય નહીં તો તેમાં અરસંખ્યાત સમુચ્છીમ મનુષ્યોની ઉત્પત્તિ થઈ જાય છે.





- \* માગ્રાનો ખ્યાલો ટાંકણું ટાંકીને પરછવવા લઈ જવો. ઉધાડો નહીં.
- \* મર્યાદા સચવાચ તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો.
- \* જ્યા ત્યાં સ્થંડિલ-માત્રુ પરછવવું નહીં. બીજાને અપીતિ થાય તેવું ન કરવું.
- \* આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાંજના-લઘુતા થવી જોઈએ નહીં.
- \* કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરછવવું.
- \* દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા નિસિહી અને બહાર નિકળતા આવસ્સહિ પ્રણવાર કહેવું.
- \* ધૂમ્રસવાળું વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિકળતુ નહીં. સ્થંડિલ-માત્રુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે કાંમળી ઓટી જ્યણા પૂર્વક જવું.
- \* લાઈટમાં કઈ પણ વાંચવું નહીં. લાઈટનો ઉપયોગ કરવો નહીં.
- \* પાણી વાપર્યા બાદ ગલાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠોં ગલાસ માટલામાં નાંખવો નહીં.
- \* કામળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી-ખીંટી વિ. ઉપર છુટી કરી રાખવી (સીધી ગડી ન કરવી).
- \* દોરી વિ. ઉપર સુકવેલા કપડા સુકાતા તુરંત લઈ લેવા, ફર ફર ફુફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય.
- \* ગુરુ મ.સા. ની આજાનું અક્ષરશા પાલન કરવું.



ઃ ઃ

- \* ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહીં, ફોન કરાવવો નહીં.
- \* કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ વાપરી શકાય નહીં.
- \* કપડા વિ. સુકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઈએ.
- \* થુક-ગાળફો-શ્લેષ્ણ વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઈએ.
- \* પરસેવાવાળા કપડા તુરંત સુકાવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહીં, સુકાઈ જતા તુરંત લઈ લેવા.
- \* ગરમી લાગતા કપડા પુંઢા વિ. થી પવન નાંખવો નહીં.
- \* કપડા ગાટકવા નહીં.
- \* તિર્યાનો પણ ર્યશ થાય નહીં.
- \* જુઠું બોલવું નહીં.
- \* કોઈની વસ્તુ અડવી નહીં.
- \* વિજયતીય તરફ રાગ દ્રષ્ટીથી જેવું નહીં.
- \* મન બહેકાવે એવા કુવાંચન, કુશ્વાણ , કુવિચાર કરવા નહીં, પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહીં.
- \* વાત-વિકથા-ગાયામાં સમય બગાડવો નહીં.
- \* નખ કાપવા જ પડેતો તેને ચુનામાં ચોળી કપડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા.
- \* અરીસામાં શરીર, મોઢું જેવું નહીં.
- \* નીવિમાં થોડી ઉણોદરી ( ભુખ કરતા ઓછું ખાવુ ) રાખવી આકંદ ભોજન ન કરવું.
- \* નીવિમાં દ્વાયો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે

ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ

દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહીં વિ.વિ.

- \* ભુલ થતાની સાથે જ આલોચના નોંધી લેવી.
- \* રાત્રે દ કલાકથી અધિક સુવુ નહીં (દિવસે તો સુવાનુ છે જ નહીં).
- \* પ્રતિકમણ વિ. તમામ કિયાઓ સમુહમાં ગુરુસાક્ષિઓ કરવી.
- \* ચરવળો મુહુપત્તિ વિ. એક હાથથી દૂર જવા જોઈએ નહીં.
- \* સવારે પ્રતિકમણ વિ. કિયા કરી ઉંઘવુ નહીં.
- \* નિષ્કારણ શરીર દબાવવું નહીં.
- \* ભાઈઓએ બધા સાધુ મ.સા. ને, બહેનોએ બધા સાધ્વીજુ મ.સા. ને બે ટાઈમ વંદન કરવું જોઈએ.
- \* પ્રતિકમણાદિ કિયામાં ગુરુ. મ. આવે તે પહેલા જ હાજર થઈ જવું.
- \* કોઈની પણ સાથે આપણા કે સામી વ્યક્તિના સ્વભાવ દોષથી સંઘર્ષ, સંકલેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિછામિ દુક્કડમું દઈ દેવું.
- \* ચાર્ટુમાસિક કાળમાં બપોરે કાળનો કાળે લેવો ફરજુયાત છે.
- \* સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભુલવું નહીં.
- \* ચુનાવાજુ પાણી રૂ કલાક ચાલે, બાઈ નિર્જીવ ભૂમિમાં સુકામાં રૂ કલાક ની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે વધારાનું પાણી જચણા પૂર્વક પરઠવવું.
- \* પરોટીયે તમામ કિયાઓ મનમા કે અત્યંત ધીમા અવાજે કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ના થાય, ઊઠી ના જાય.

## ઉપાસ તપવા તપ-જપ

### કિયાનુ સર્વૈયુ

- ૨૧ ઉપવાસ                    ● ૫ હજાર લોગસસનો કાયોત્સર્ગ
- ૧૦ આચંબિલ                    ● ૫ હજાર ખમાસમણા
- ૧૬ નિવિ                        ● ૧ લાખ નવકાર મંત્રનો જાપ
- ૪૭ પૌષ્ઠદ                        ● પ્રવર્યન શ્રવણ • સ્વાધ્યાય દ્વારા જ્ઞાનશુદ્ધિ • દેવવંદન, જાપ  
વિ. દ્વારા દર્શનશુદ્ધિ • પૌષ્ઠદ કિયા દ્વારા ચારિત્રશુદ્ધિ.

᳙ ᳙ ᳙ ᳙ ᳙

સો ડગલાની બહાર જઈને આવતા, સ્થંડિલ-માત્રુ પરઠવીને  
આવતા ધરિયાવહી કરી ગમણાગમણે સૂત્ર બોલવું

### ગમણાગમણે સૂત્ર

ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ગમણાગમણે આલોઉં ? ઇચ્છા, ધ્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ , આદાન બંડમતા નિદ્રખેવણાસમિતિ, પારિદ્રાપનિકા સમિતિ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ આદ પ્રવર્યનમાતા શ્રાવકતણે ધર્મ સામાયિક પૌષ્ઠદ લીધે રડી પેરે પાર્યું નહીં, ખંડણા વિરાઘના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી તરસ ભિચામિ દુક્કડમ્...

મુહુપતિનું પ્રતિલેખન ૫૦ બોલ પૂર્વક કરવાનું હોય છે બોલ સમજુને ગોળી લો, તે પ્રમાણે વિધિપૂર્વક મહુપતિ પ્રતિલેખન કરવી.

## મુહુપત્રિના પત્રાંસ બોલ

- (૧) સૂત્ર અર્થ તત્ત્વ કરી સદેહું (૨) સમ્યકૃત્વમોહનીય  
 (૩) મિશ્રમોહનીય (૪) ભિષ્યાત્વમોહનીય પરિહણ (૫) કામરાગ  
 (૬) સ્નેહરાગ (૭) દેષ્ટ્રાગ પરિહણ (૮) સુદેવ (૯) સુગુરુ  
 (૧૦) સુધર્મ આદરણ (૧૧) કુદેવ (૧૨) કુગુરુ (૧૩) કુધર્મ પરિહણ  
 (૧૪) જ્ઞાન (૧૫) દર્શન (૧૬) ચારિત્ર આદરણ (૧૭) જ્ઞાનવિરાધના  
 (૧૮) દર્શનવિરાધના (૧૯) ચારિત્રવિરાધના પરિહણ (૨૦) મનગુપ્તિ  
 (૨૧) વચનગુપ્તિ (૨૨) કાયદંડ આદરણ (૨૩) મનદંડ  
 (૨૪) વચનદંડ (૨૫) કાયદંડ પરિહણ (૨૬) હાસ્ય (૨૭) રતિ  
 (૨૮) અરતિ પરિહણ (૨૯) ભય (૩૦) શોક (૩૧) દુર્ગાછા પરિહણ  
 (૩૨) કૃષ્ણલેશ્યા (૩૩) નીલ લેશ્યા (૩૪) કાપોતલેશ્યા પરિહણ  
 (૩૫) રસગારવ (૩૬) અદ્ભુતગારવ (૩૭) શાતાગારવ પરિરહણ  
 (૩૮) માયાશત્ય (૩૯) નિયાયશત્ય (૪૦) ભિષ્યાત્વસત્ય પરિહણ  
 (૪૧) કોદ્ધ (૪૨) માન પરિહણ (૪૩) માયા (૪૪) લોભ પરિહણ  
 (૪૫) પૃથ્વીકાય (૪૬) અપ્કાય (૪૭) તેઉકાયની જ્યણા કરણ  
 (૪૮) વાઉકાય (૪૯) વનસ્પતિકાય (૫૦) અસકાયની ‘જ્યણા કરણ’

**કુ કુ કુ કુ કુ**

**સૂચના :-** મુહુપત્રિ ૫૦ બોલથી, ચરવળો-કંદોરો દંડસણ વિગેરે  
 ૧૦ બોલથી તથા બાકીનાં ઉપકરણોનું અને થાળી, વાટકો, ગલાસ,  
 લોટાનું પડિલેહણ ૨૫ બોલથી કરવું.

બહેનોને ૩૨-૩૩-૩૪ અને ૩૮ થી ૪૪ સુધીના ૧૦ બોલ  
 બોલવાના નથી અર્થાત ૪૦ બોલ જ બોલવાના હોય છે.

## નામસ્તવાનાં વામતે બોલવાનું પણ

પહેલું (અટારિયું) ઉપધાન : શ્રી પંચમંગલમહાશ્રુતસ્કર્ધાય નમઃ  
નીજું (અટારિયું) ઉપધાન : શ્રી પ્રતિકમણશ્રુતસ્કર્ધાય નમઃ  
ચોથું (ચોકિયું) ઉપધાન : શ્રી ચૈત્યસ્તવઅદ્યયનાય નમઃ  
ઇકુ (ઇકિયું) ઉપધાન : શ્રી શ્રુતસ્તવ- સિદ્ધસ્તવઅદ્યયનાય નમઃ  
પ્રીજું (પાંત્રીશું) ઉપધાન : શ્રી શક્ષસ્તવ- અદ્યયનાય નમઃ  
પાંચમું (અટઠાવીશું) ઉપધાન : શ્રી નામસ્તવઅદ્યયનાય નમઃ

## કાઉસાગ્રાની વિધિ


પહેલા : અટારિયામાં ઈચ્છાકારેણ સંદિસાહ ભગવન શ્રી પંચમંગલ  
મહાશ્રુતસ્કર્ધ આરાધનાર્થે કાઉસાગ્રા કરું ? ઈચ્છાં, શ્રી  
પંચમંગલ મહાશ્રુતસ્કર્ધ આરાધનાર્થે કરેમિ કાઉસાગ્રાં,  
વંદણવત્તિઆએ, અન્નત્થા કહી, ૧૦૦ લોગરસનો  
સાંગરવરગાંભીરા સુધીનો કાઉસાગ્રા કરવો. તેવી રીતે  
નીજા : અટારિયામાં શ્રી પ્રતિકમણશ્રુતસ્કર્ધ આરાધનાર્થે કરેમિ  
કાઉસાગ્રાં વંદણવત્તિઆએ, અન્નત્થ.  
પ્રીજા : (પાંત્રીશા) ઉપધાનમાં-શ્રી શક્ષસ્તવઅદ્યયન આરાધનાર્થે  
કરેમિ કાઉસાગ્રાં વંદણવત્તિઆએ, અન્નત્થ.  
ચોથા : (ચોકિયા) ઉપધાનમાં - શ્રી ચૈત્યસ્તવઅદ્યયન  
આરાધનાર્થે કરેમિ કાઉસાગ્રાં, વંદણવત્તિઆએ, અન્નત્થ.  
પાંચમા : (અટઠાવીશા) ઉપધાનમાં - શ્રી નામસ્તવઅદ્યય  
આરાધનાર્થે કરેમિ કાઉસાગ્રાં, વંદણવત્તિઆએ, અન્નત્થ.  
ઇકું : (ઇકિયા) ઉપધાનમાં શ્રી શ્રુતસ્તવ- સિદ્ધસ્તવ આરાધનાર્થે  
કરેમિ કાઉસાગ્રાં, વંદણવત્તિઆએ, અન્નત્થ.

**સામજુ લે, આવી ભૂલો કશે તો દિવસ પડશે,  
ઓટલે ઉપધાન બાદ ઓટલા પોષદોપવાસ  
પાયશીત રૂપે કરી કરી આપવા પડશે.**

- ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિકળશે તો...
- એઠું મુક્શો તો...
- પરયફ્ખાણ પારવાનું ભૂલાશે તો...
- વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનું રહી જશે તો...
- પરમાત્માના દર્શન કરવાના રહી જશે તો...
- દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું રહી જશે તો...
- મુહૃપત્રિ ખોવાઈ જશે તો...
- સવારે કિયા પૂર્વે અને સાંજે કિયા બાદ સ્થંડિલ જવાનું થશે તો...
- બહેનોને અંતરાયના કારણે,
- મુદ્દસી પરયફ્ખાણ પારવાનું ભૂલશો તો...
- સચિત વસ્તુ - કાચી વિગાઈ કે લીલોતરી ખાવામાં આવી જાય તો...
- દેવવંદન કરવાના રહી જાય તો...
- સાથે રાખેલ કોઈપણ ઉપકરણ, નવકારવાળી ખોવાય તો...
- સવાર - સાંજની કિયા કરવાની રહી જાય તો...

## જાણવા જેતુ - આદિવાનુ

- ❖ ગમે તે કારણે દિવસ પડે તો પૌષ્ટિ ઉપધાન બાદ ફરી કરી આપવા પડે, ઉપધાનનથી સાચે જ આલોચનાના પૌષ્ટિ કરો તો આયંબિલથી થાય, ઉપધાનમાંથી નિકળીને કરાય તો ઉપવાસ પૂર્વક જ આઠ પ્રછરનો પૌષ્ટિ કરવો પડે.
- ❖ પ્રથમ પ્રછર વીતી ગયા બાદ પૌષ્ટિ લઈ શકાય નહીં.
- ❖ બંને ટાઈમ કિયા કરતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જોવી, (હાડકાં પંચેન્દ્રયનું-કલેવર-ઈડા-પર્ઝ-લોહી-વિ. નથી ને ? તેની ચકાસણી કરી લેવી)
- ❖ સંદ્યા સમયે માત્ર પરછવવાની જગ્યાનું નિરીક્ષણ બારીકાઈથી દરેકે કરવું. (ત્યાં કીડીના નગરા, જીવાતો, જીવ-જંતુ, વિ. નથી ને, એ જોઈ લેવું.)
- ❖ જે દિવસે ઉપધાનમાંથી નિકળવાનું થાય તે દિવસે એકાસણું અને રાત્રી પૌષ્ટિ ફરજુયાત કરવાનો છે.
- ❖ માટ પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું હોય છે.
- ❖ કારણ આવી પડે કે સંયોગો અનુકૂળ ના હોય તો પ્રથમ અટારીયું પૂર્ણ કરીને નીકળી શકાય. બાકીના ઉપધાન ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલું અટારીયું લેખે ના ગણાય.
- ❖ ઉપવાસ, આંયબિલ કે નિવિ પરિમુટ જ કરવાના હોય છે. ઉપવાસ અને આયંબિલનું પરિમુટ તપમાં ગણાતું નથી.



- જ્ઞ નીવિનુ પુરિમુઠ તપમાં ગણાય. ૧ પુરિમુઠ = બે આની તપ,  
૮ પુરિમુઠ = એક ઉપવાસ.
- જ્ઞ સુદ ૫, ૮, ૧૪ અને વદ ૮, ૧૪ ના નિવિ આવે તો તેના બદલે  
આયંબિલ કરવું પડે છે.
- જ્ઞ ઉપધાન પ્રવેશ બાદ પહેલા ત્રણ દિવસ સુધી નવા વસ્ત્ર-ઉપકરણ  
વિ. જરૂરી સામગ્રી ગ્રહણ કરી શકાય, પછી નહીં.
- જ્ઞ સવાર સાંજની કિયા વખતે, પવેયણાની વિધિ વખતે, વાપર્યા  
પછીના થૈત્યવંદન વખતે, વાચનાલેતી વખતે, પચ્ચાફ્ખાણ પારતી  
વખતે, ઉપધાન પ્રવેશ અને માળારોપણની કિયા વખતે  
સ્થાપનાચાર્ય ખૂલ્લા રાખવા જરૂરી છે.
- જ્ઞ ઉપધાનમાંથી નિકળ્યા બાદ માળા પહેરવાની હોય તો આગામા  
દિવસે એકસણું, માળાના દિવસે ઉપવાસ અને માળા પછીના  
દેવસે એકસણું કરવાનું હોય છે.
- જ્ઞ ઉપધાનમાં નીવિ કે આયંબિલમાં લીલોતરી, આખુ કઠોળ,  
ખાખરા પાપડ કે એવી કક્ક અવાજ થાય તેવી વસ્તુ, કાચી  
વિગાઈ વિ. કલ્પે નહીં.
- જ્ઞ અરીઓએ વાંચનાના દિવસે માથામાં તેલ નાખવું હોય તો નાંખી  
શકે (પાંચ તિથિએ વાચના આવે તેમાં અને છકીયા ચોકીયાની  
વાંચનામાં તેલ નંખાય નહીં)
- જ્ઞ દક્ષિણ દિશા (યમરાજની દિશા હોઈ) તરફ પગ કરીને સુવું  
નહીં.





- ❖ ઉપયોગમાં આવતા તમામ સૂત્રો અર્થ સહિત બધા ગોખી લેવા.
- ❖ સુતી વખતે સંથારા ઉપર ઉત્તરપણો અવશ્ય પાથરવો, સુતા સંથારો ઉત્તરપણો સિવાય અધિક ઉપકરણ વાપરવું નહીં.
- ❖ આપણા નિમિતો સ્પેશિયલ નવા આરંભ સમારંભ કરાવવા નહીં.
- ❖ ‘અહી આવ-જા, લાઈટ-પંખા ચાલુ કર, બંધ કર, આ લાવ-તે લાવ’, વિ. આડાપૂર્વકની સાવધ ભાષા જોતવી નહીં.
- ❖ બારી-બારણા ખોલ બંધ કરતા ચરવળાથી કે દંડાસનથી ચારે બાજુના ખૂણાઓ બરાબર પૂંજવા-પ્રમાર્જવા (ગરોળી વિ. જીવો હોય તો નિકળી જાય - ચગાદાય નહીં માટે)
- ❖ પાટ, પાટલા, ટેબલ, ખુરસી, વિ. કોઈપણ વસ્તુ લેતા મુક્તા ચરવળાથી વારંવાર પૂંજવાનો ઉપયોગ રાખવો.
- ❖ વ્યાખ્યાન સાંભળતી વખતે નવકારવાળી ગણવી નહીં.
- ❖ સુવા-બેસવા-જમવા વિ. માં જગ્યાની પસંદગી જેવી ક્ષુલ્લક બાબતમાં સંઘર્ષ કરવો નહીં. મન બગાડવું નહીં.
- ❖ ‘હું અને મારુ’ આપણે ભલા ને આપણું કામ ભલુ આવી સ્વાર્થવૃત્તિ છોડી, બને એટલો પરાર્થ કરવો, આજુ-બાજુવાળાની સેવા-ભક્તિની તકો ઝડપી, દિલ દઈને સેવા કરવી.





- જ્ઞ બાળક હોય, માંદા હોય, વૃદ્ધ, અશક્ત હોય, એવાઓની સવિશેષ ભક્તિ-પૈયાવસ્ય કરવી, તેમનું બધી રીતે ધ્યાન રાખવું. ઠુઠા મસ્કરી, હસાહસ કરવા નહીં, ગામગપાટા મારવા નહીં, પારકી પંચાયત કરવી નહીં.
- જ્ઞ કિયા-વિધિથી અભાસ, નિમનુરૂપે કિયા કરનારાઓ પ્રત્યે ઘૃણા તિરસ્કાર કે અસદ્ભાવ ઉભો કરવો નહીં.
- જ્ઞ ઉપધાન એ એક નિયત તપ છે. તેથી કલ્યાણકનો તપ તેમાં આવી જાય (ગણાઈ જાય) (હીરપ્રશ્નોત્તર)
- જ્ઞ ઉપધાનની વાંચના શ્રાવિકાઓ ઉભા ઉભા તથા શ્રાવકો ચૈત્યવંદન મુદ્રામાં સાંભળો (હીરપ્રશ્ન)
- જ્ઞ નિવિ કે આચંબિલ કર્યા બાદ જગચિંતામણીથી જય વિચરાચનું ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી વાપરી શકાય.
- જ્ઞ રાત્રી પૌષ્ટિ ઉચ્છર્યા પછી પાણી વાપરી શકાય નહીં.
- જ્ઞ સાચું પણ ઉધાડે મુખે બોલવું એ સાવધભાષા કહેવાય એમ ભગવતી સૂત્રમાં કલ્યુ છે. માટે બોલતા મુહૂરતિનો ઉપયોગ રાખવો.



સાંજ પડે આખા દિવસની આલોચના  
ચાદ કરી કરીને નોંધ કરી લો...

### આવી આવી ક્ષતિઓથી આલોચના આવે...

- ❖ પ્રતિલેખન કર્યા વગરુના વસ્ત્ર પાત્ર ઉપકરણ વાપર્યા.
- ❖ મુહુપત્તિ, ચરવળો એક છાથથી દૂર રહ્યો, વચ્ચે આડ પડી...
- ❖ રાત્રે કાનામાં કુંડલ ના નાખ્યા
- ❖ સ્થાપનાજી પડ્યા.
- ❖ વિજાતીયનો સંઘર્ષો થયો.
- ❖ કાજમાથી કીડી , મંકોડા, માંકડ, મર્યાદ, માણી વિ. કલેવર નિકળ્યા.
- ❖ કાજમાથી સચિત દાણા વિ. નિકળ્યા.
- ❖ જમતા જમતા એઠા મોટે બોલ્યા.
- ❖ સચિતા, લિલોતરી, નિગોદ, ધન-ધાન્ય, કાચુ પાણી દાણા વિ. ના સંઘર્ષો થયા.
- ❖ દિવસે ઉંઘ્યા.
- ❖ કામળી કાળમાં કામળી વગર બહાર ગયા.
- ❖ દંડાસણ લીધા વગર રાત્રે ચાલ્યા.
- ❖ વાડામાં સ્થંડિલ ગયા.
- ❖ પ્રતિકમણ બેઠા બેઠા કર્યુ.



- ❖ કાયોત્સર્વ બેઠા બેઠા કર્યા.
- ❖ ખમાસમણા વગર કારણે બેઠા બેઠા દીધા.
- ❖ ઉધાડા મુખે મુહૂપતિના ઉપયોગ વગર બોલ્યા.
- ❖ સંસારીઓ સાથે સાવધ વાતો કરી
- ❖ છાપા-મેગેગીન વિ. (ધાર્મિક સિંવાયનુ) નુ સાહિત્યવાંચન કરી ટાઈમ બગાડ્યો.
- ❖ દેવ-ગુરુ-ધર્મ કે સાધર્મિકોની નિંદા કરી.
- ❖ કોઈના ઉપર પર ગુર્સો થઈ ગયો.
- ❖ કોઈની સાથે સંઘર્ષ થયો. બોલાચાલી થઈ.
- ❖ પચ્ચાખાણ પારવાનું ભૂલ્યા.
- ❖ માંદગી વિ. ના કારણે ડોક્ટર બોલાવ્યા, બી.પી. મપાવ્યુ, દવા, ઈજેક્શન લીધા વિ.
- ❖ કોઈપણ ઉપકરણ ખોવાયું કે તુટયું.
- ❖ વરસાદના છાંટા લાગ્યા.
- ❖ સાંજે વસતિ (ઠલે માત્ર પરછવવાની જગ્યા) જોવાનું ભૂલ્યી ગયા.
- ❖ ચોપડી, નવકારવાળી, સાંપડા, ચરવળા વિ. કોઈપણ ધાર્મિક ઉપકરણ ઉપર પગ લાગ્યો, ઢેસ લાગ્યી.



## ઉપધાનની આવસ્યકતા-મણાત્મ

### બતાવતુ મહાનિર્ણય સૂત્ર

**સવાલ :** હે ભગવાન् પંચમંગાત મહાશ્રુતસ્કર્ધનુ વિનય ઉપધાન અત્યંત દુષ્કર બતાવ્યું છે. તો આવો તપ જીવો કેવી રીતે કરી શકે ?

**જવાબ :** હે ગૌતમ જે કોઈ જીવ આ નિયંત્રણને ના ઈચ્છે, પંચમંગાતમહાશ્રુતસ્કર્ધસૂત્રને (નવકારમંત્રને) ઉપધાન કર્યા વગર ભણો, ભણાવો, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ના હોય, તેદ્રટધર્મી ના હોય, તે ગુરુની હીલના કરે, સૂત્ર-અર્થ ઉભયની હીલના કરે, તે ગુરુની હીલના કરે, સૂત્રની ચાવૃત ગરુની હીલના કરનાર હોય, તે ભૂત-ભવિષ્ય અને વર્તમાન તીર્થકરોની આશાતના કરે, આચાર્ય, ઉપાદ્યાય, સાધુની હીલના કરનાર બને, તે અનંત અરિહંત સિદ્ધ સાધુઓની હીલના કરનાર બને, તે અનંત સંસારમાં રાજો, ચોરાસી લાખ ચોનીમાં દીર્ઘ કાળ સુધી-ભરકે, અગણિત દુઃખો ભોગાવે.

તેથી ઉપધાન કર્યા પહેલા જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે અવસર મળે, વિના વિલંબે, વિદ્યપૂર્વક અવશ્ય ઉપધાન કરી લેવા જોઈએ.

ઉપધાન કર્યા પહેલા બાળક વિ. ને જે નવકાર વિ.

એ એ

ભણાવાય છે તે જુતાચાર થી ભણાવાય છે. સમજણો  
થયા બાદ વિના વિલંબે ઉપધાન કરી લેવા જોઈએ.

(તા.ક.: આ વાત ઉત્સર્ગથી નિશ્ચયનયનો આસરો કરી જે  
નાસ્તિક જીવો ઉપધાનનો અપલાપ કરે છે, તેના માટે  
બતાવવામાં આવી છે.)

### ઉપધાનના દિવસ-તપ અને વાચનાનો યંત્ર

### ૬ ઉપધાનના દિવસ, તપ અને વાચનાનો યંત્ર

| ઉપધાન | ઉપધાનનું નામ   | દિવસ | કુલ તપ | જાચ્છા કથારે કઈ?                            |  |  |
|-------|--|------|--------|---|--|--|
|       |  |      |        | પહેલી                                       | બીજી   | ત્રીજી   |
| ૧     | પંથમંગળ<br>મહાશુતકંદ્ય<br>(નમસ્કાર મંત્ર)  | ૧૮   | ૧૨॥    | પાંચ ઉપવાસે<br>પ્રયમ ૫ પદની                 | ૩॥ ઉપવાસે<br>છેદ્વા ૪ પદની                                 | ----   |
| ૨     | પ્રતિકમણ શુતકંદ્ય<br>(અર્દિયાપ્હી,<br>તરસુઓપરી)  | ૧૮   | ૧૨॥    | પાંચ ઉપવાસે<br>“ભેગે જુદી<br>વિરાહિા”સુધી   | ૩॥ ઉપવાસે<br>ધાર્મિ કાઉસઙ્ગ<br>સુધી.                       | ----   |
| ૩     | શક્તસ્તપાદ્યથન<br>(નમુલ્લાં સૂર્ય)   | ૩૫   | ૧૬॥    | ત્રણ ઉપવાસે<br>“પુરિસ્વરગંધ<br>હત્યાં”સુધી. | ૬ ઉપવાસે<br>“દ્રઘમરથાઉરેટ<br>સક્રતદ્વીણ સુધી               | ૮॥ ઉપવાસે<br>સંખ્ય તિવિ-<br>દેશ વંદામિ<br>સુધી |
| ૪     | શૈત્યસ્તપાદ્યથન<br>(સંઘલોઽા અરિંદ્ય<br>ચેક્ષે અન્નત્યો)                                    | ૪    | ૨॥     | ૨॥ ઉપવાસે<br>“અઘ્યાણ<br>શોસિરામિ” સુધી      | -  | -  |
| ૫     | નામસ્તપાદ્યથન<br>(લોગસ સૂર્ય)  | ૨૮   | ૧૫॥    | ૩ ઉપવાસે<br>પહેલી ગાથા                      | ૬ ઉપવાસે<br>૨-૩-૪ ગાથા                                     | ૬॥ ઉપવાસે<br>૫-૬-૭ ગાથા                        |
| ૬     | શુતકંદ્ય-સિદ્ધસ્તપા-<br>દ્યથન (પુદ્ભરવર<br>દીપદર્ક, સિદ્ધાણં,<br>બુદ્ધાણં<br>પૈથાપદ્યગરાણ) | ૬    | ૪॥     | ૨ ઉપવાસે<br>પુદ્ભરવર<br>સંપૂર્ણ.            | ૨॥ ઉપવાસે<br>સિદ્ધાણં બુદ્ધાણં<br>પૈથાપદ્યગરાણ<br>સંપૂર્ણ. | -  |

## ઉપધાન સમાપન કર્યા બાદ આટલું

અવશ્ય કર્યું જરૂરી છે.

ઉપધાનની આરાધનાથી તમે તપસ્વી થયા, સુશ્રાવક થયા, સૂત્ર અર્થના અધિકારી થયા, પરમાત્માની આડાના આરાધક થયા.

હવે જિનશાસનમાં તમારું સ્થાન ઊંચું આવ્યું લોકમાં પણ તપના પ્રભાવે, આરાધનાના પ્રભાવે તમે સન્માનનીય બન્યા, આદરણીય બન્યા.

હવે લોકોની તમારા પ્રત્યે અપેક્ષા પણ વધી છે. તમે ધાર્મિક છો એવી છાપ તમારા માટે સહજ ઉપસી આવી છે. એટલે તમારી જ્વાબદારી વધી જાય છે.

ઉચ્ચ ધાર્મિક ભૂમિકાને અનુરૂપ તમારા આચાર-વિચારો ઘડવા પડશે, નિયત આચાર મચ્યાદાનું નિયમ પૂર્વક કર્યક પણે અવશ્ય પાતન કરવું પડશે.

અન્યથા લોક કહેશે, જોયુ, એકબાજુ ઉપધાન કર્યા ને બીજુ બાજુ કેવા તાગડધીના - જલસા કરે છે.

આમાં શાસનની, જૈન ધર્મની અપભ્રાજના છે.

શાસનહીલના ન થાય એ માટે પણ હવે સીધા ચાતવું પડશે. લોકવ્યવહાર અને સમાજમાં આચાર વિચાર દ્વારા ઉપધાન નહીં કરેલ વ્યક્તિ કરતા આપણું વ્યક્તિત્વ સહજ અલગ તરી આવવું જોઈએ.

આપણી ધાર્મિક કહૃતતાથી પ્રભાવિત થઈ આપણા અસ્તિત્વમાં સમાજ પણ અમુક અયોગ્યલીલા કરતા કરતો રહે એવું વ્યક્તિત્વ આપણે ઉભુ કરવાનું છે.

ઉપધાન તપ કરી જો આવા ધાર્મિક યુસ્તિતાવાળા પુન્ય સામાજનું સર્જન થશે તો ભાવિમાં પ્રભુનો આચાર માર્ગ સરળતાથી જ્ય-વિજયને પામશે.

ઃ ઃ

ઉપધાન બાદ અમુક પાપ કરતા અંતર ડંખતુ રહેવુ જોઈએ,  
પાપકિયા પૂર્વે અચૂક વિચાર આવવો જોઈએ કે મે ઉપધાન કર્યા,  
ને હું આ પાપ કર્યુ ? આ વિચાર કાં પાપકિયાને તોડી નાંખશે,  
કાં પાપના રસને તોડી નાંખશે.

આ શુભ વિચાર જ ઉપધાન તપ સ્મૃતિને જીવનભર તાજગી પૂર્ણ  
રાખશે.

તો, આજે જ આટલો નિધાર અચૂક કરી લો.

- ❖ પરમાત્માના દર્શન વિના મોટામાં પાણીનું ટીપું નાંખીશ નહીં.
- ❖ પરમાત્માની પૂજા ગમે તેવા સંયોગોમાં અવશ્ય કરીશા.
- ❖ માતા-પિતા ને પગે લાગીશા, તેમની આઙા શિરોમાન્ય કરીશા.
- ❖ રાત્રી ભોજન કરીશા નહીં, સંયોગો પ્રતિકુળ હશે તો એક જ વાર  
ભાણે બેસી જમી લઈશા.
- ❖ કાંદા, બટાટા, આદુ, મૂળા, ગાજર, લસણ, જેવા અભક્ષય પદાર્થો  
આજીવન વાપરીશા નહીં.
- ❖ આઈસ્ક્રીમ ખાઈશા નહીં.
- ❖ છોટલોમાં જઈશ નહીં, અભક્ષય ખાન-પાન દ્વારા શરીરને  
અભડાવીશ નહીં.
- ❖ પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ કરીશા.
- ❖ માંસ મદિરા, ચોરી, જુગાર, શિકાર, પરસ્પ્રીગમન, વેશ્યાગમન  
જેવા વ્યસનોનું આજીવન સેવન કરીશ નહીં.
- ❖ મધ્ય માખણ, પીગા, જેવા અભક્ષય દ્રવ્યો વાપરીશ નહીં.
- ❖ જીવોની કતલથી પેદા થતી ઊનની વસ્તુ-ચામડીની વસ્તુ (પર્સ-  
ચંપલ-કોટ-કપડા) સૌદર્યના સાધનોનો ઉપયોગ કરીશ નહીં.
- ❖ નવરાત્રી, ગણેશ, હોળી, શરદપૂજન, જેવા તમામ લૌકિક પર્વોમાં  
ભાગ લઈશ નહીં.
- ❖ માળના દિવસે વાર્ષિક ઉપવાસ અને માસિક ઓછામાં ઓછું બેસણુ  
કરીશા.

હ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ ઃ

- 
- ❖ રોજ ઓછામાં ઓછું નવકારશીનું પરચક્ખાણ તો કરીશ જ.
  - ❖ ઓછામાં ઓછું વાંચ તિથિ બ્રહ્માચર્યનું પાલન કરીશ.
  - ❖ બર્થ ડે પાર્ટી, કીટી પાર્ટી, મેરેજ પાર્ટી, વિ. પાર્ટીઓમાં જ્યાં પણ મર્યાદા અને સંસ્કૃતિના છેડે ચોક લીરા ઉડતા હોય તેવા કાર્યક્રમોમાં હાજરી આપીશ નહીં.
  - ❖ નાટક સિનેમાંનો ત્યાગ કરીશ કે નિયમ કરીશ.
  - ❖ બાવીસ અભક્ષય, બંગ્રીસ અનંતકાયનો સર્વથા ત્યાગ કરીશ.
  - ❖ પાન, બીડી, સીગારેટ, તમાકુ, ગુટકા, જેવા વ્યસનોના ફંદામાં ફ્રાઇશ નહીં.
  - ❖ ગર્ભપાત, ખૂન, ચોરી-ધાડ, જેવા નરકમાં લઈ જનારા મોટા પાપોનું સેવન કદાપિ કરીશ નહીં.
  - ❖ રોજ બધા પારાની બને તો પ્રણ નવકારવાળી ગણી એ વર્ષમાં નવ લાખ નવકારની મૂડી ઉભી કરીશ.
  - ❖ એક નવકારવાળી તો અવશ્ય ગણીશ.
  - ❖ ઘંધામાં મોટી ચોરી, કોકને શીશામાં ઉતારવા, બીજાની મોટી રકમ દબાવી દેવી, બનાવટી માલ પદરાવવો વિ. જેવા મોટા કૌભાંડો સર્વથા વર્જીશ.
  - ❖ પ્રાણીઓની નિર્મમ હત્યામાંથી તૈયાર થાએલ લાલી, લીપસ્ટિક પર્સ, પરફ્યુમ, પાવડરો, વાંદાના ભુકામાંથી બનતી તમામ કેટબરી, ચોકલેટ, કીટકેટ ચ્યુર્ઝામ વિ. દ્રબ્યો, ઈડાના રસમાંથી બનતી આઈસ્કીમ વિ. વસ્તુઓ સંદર્ભ ત્યાગ કરીશ.
  - ❖ મનને બહેકાવનાર, સંસ્કારનો કર્યક્રમધાણ કાઠનાર ટી.વી. વિડિયો, કેબલ, ચેનલો, ઈન્ટરનેટ, વિ. નો ત્યાગ કરીશ.
  - ❖ રોજ ઓછામાં ઓછું ૧૦ મિનિટ સાદ્દ સાહિત્યનું વાંચન કરીશ.
  - ❖ ૧૪ નિયમ ધારીશ.
  - ❖ શ્રાવકના ૧૨ પ્રતિ ગ્રહણ કરીશ.
  - ❖ ‘ક્યારે ચારિત્ર મળો’ ? એવી શુભ ભાવના રોજ ભાવીશ.
-

## ઉપદ્ધાન ટાપના રાયાંઓફક્સ બોર્ડો

- ધારેરાવ નિવાસી (હાલ મુંબઈ)
   
શેઠશ્રી દેવરાજજી મોહનરાજજી ગુંદેચા,  
છ. પારસ દેવરાજજી ગુંદેચા
- શેઠશ્રી રત્નલાલ છોટાલાલ શાહ - મુંબઈ
- શ્રી વસનજી તેજસી ગાલા - દેવપુર (કચ્છ)
- શ્રી હેમલતાબેન રામજી વોરા - નવીનાગ (કચ્છ)
- માતુશ્રી ગંગાબેન થાવરભાઈ રીટા લાકડીયા  
(કચ્છ)
- ગેવરબેન ભવાનજી શાહ (કાંડાગારા) કચ્છ
- સાફરબેન કેશાવજી જેઠાલાલ સાવલા -  
બાડા (કચ્છ)

• પ્રવેશ પ્રવયમ મુદ્દુ •

ખાસો સુદ-૧૦ (દશોરા) તા. ૨૩-૫૦-૦૫, સાનિવાર

• દિવીલિ પ્રવેશ મુદ્દુ •

ખાસો સુદ-૧૨, સૌમયાર, તા. ૨૫-૫૦-૦૫, સૌમયાર

માન્ય રોપણ :- કાંડાક ૫૬-૧૨, તા. ૮-૫૨-૦૫

# અહું નમઃ

## ઉપધાન એટલે...

અસંયમથી સંયમ તરફ પ્રયાણ  
અનાયારથી આયાર તરફ પ્રયાણ  
ભોગથી ત્યાગ તરફ પ્રયાણ  
સંસારથી મુક્તિ તરફ પ્રયાણ..

ઉપધાનમાં - તપ - જપ  
કિયાનો બ્રિવેણી સંગમ છે.  
તપથી તન શુદ્ધ થાય છે,  
જપથી મન શુદ્ધ થાય છે.  
કિયાથી જીવન શુદ્ધ થાય છે.

ઉપધાન એટલે યોગસાધના...  
ગાણધર ભગવંત રચિત નવકાર  
વિ. સૂત્રોની યોગ્યતા તથા  
અધિકાર પ્રાપ્ત કરવા માટે  
ઉપધાનની યોગસાધનાથી  
આત્માને પરિકર્મીત કરવાનો હોય છે.



પરમાત્મા મહાવીર દેવની 33 મી  
 પાટે થયેલ માનદેવસૂરિ. મ.  
 જે શ્રાવક-શ્રાવિકાની સાધનાર્થ  
 'ઉપદ્યાનવિધિ' નામના ગ્રંથની રચના કરી છે.

## ઉપદ્યાન તપ સાધનાનું સરવૈયુ

- ૨૧ ઉપવાસ     ૫૦૦૦ લોગરસનો કાયોત્સાર
- ૧૦ આયંબિલ     ૫૦૦૦ ખમાસમણા
- ૧૬ નિવિ
- ૧ લાખ નવકાર મંત્રનો જાપ
- ૪૭ પૌષધ
- સ્વાધ્યાય દ્વારા જ્ઞાનશુદ્ધિ
- ભક્તિ-દેવ વંદન-જાપ દ્વારા દર્શન શુદ્ધિ
- પૌષધ દ્વારા ચારિત્રશુદ્ધિ

